

રે.દિ.મુ.નં.૨૧/૧૬.

આંક-૫ લગત હુકમ :-

(૧) આ કામે વાદી ધ્વારા આંક-૧ ની હકીકતો સાથે દાવો દાખલ કરી અને આંક-૫ ની દાદ માંગેલ છે કે, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ગોરીયાની સીમમમાં આવેલ રે.સર્વે નં. ૫૮/૧ ૭૩ એએ નવી અને અવીભાજય સરતની હે.૧-૪૦-૬૩ પોત ખરાબો હે. ૦-૧-૧ મળી કુલ ૧-૪૧-૬૪ વાળી જમીન આકાર રૂ.૧.૮૧ પૈસા વાળી જમીન કે જે ઘરવાળો તરીકે ઓળખાય છે. જે સર્વે નં.૫૮/૧ વાળી જમીન વાદીની વડીલો પાર્શ્વ કબજા ભોગવટાની છે. જેના દિશા ખુંટ નીચે મુજબ છે.

પૂર્વ - સોમલાભાઈ નારુભાઈનું ખેતર

પશ્ચિમ- ૫૮/૨ નારસીંગભાઈ દલસીંગભાઈની જમીન

ઉત્તર - રેલ્વેલાઈન

દક્ષીણ - રાજેન્દ્રભાઈ બીજીયાભાઈની જમીન

જેને હવેથી દાવાવાળી જમીન તરીકે ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ જમીનના મુળ કબજેદાર મનસુખભાઈ રેવલાભાઈ હોય રેવન્યુ રેકર્ડમાં નોંધ નં.૩૯ તા. ૨૪-૧-૫૦ થી નામ દાખલ થયેલ છે ત્યાર બાદ મનસુખભાઈ ગુજરી જતા રેવન્યુ રેકર્ડમાં ફેરફાર નોંધ નં. ૧૯૪ તા. ૩-૧-૭૭ થી વાદીનું નામ વારસાઈ હકે દાખલ થયેલ છે. દાવાવાળી જમીનના વાદી કાયદેસરના માલીક અને કબજેદાર છે.પ્રતિવાદી ખુબ જ પૈસાદાર અને રાજકીય વગ વાળા છે. દાવાવાળી જમીન યેનકેન પ્રકારે પડાવી લેવા યુક્તિઓ કરે છે અને વાદીને હેરાન કરે છે. એટલું જ નહીં ચાલુ સાલે ખેતી કરતા હોય પ્રતિવાદી દાવાવાળી જમીનમાં ખેતી કરતા અટકાવવાની પેરવી કરી ઝગડો તકરાર કરતા હોય

દાવાવાળી જમીન વાદીની કાયદેસરની માલિકીની છે તેવું ઠરાવવા તથા પ્રતિવાદીનો કોઈ હુકમ હીસ્સો નથી કે લાગભાગ નથી તેવું ઠરાવી પ્રતિવાદી વીરુદ્ધ મનાઈ હુકમ મેળવવા હાલનો દાવો લાવવાની ફરજ પડેલ છે.

સદર દાવો દાખલ કરી વાદીએ આંક-૫ નીચે નીચેની દાદ માંગેલ છે કે,

અ. દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના ગોરીયાની સીમમમાં આવેલ રે.સર્વે નં. ૫૮/૧ વાળી જમીનમાં આ કામના પ્રતિવાદીઓ જાતે કે તેમના નોકરો, એજન્ટો, માણસો પ્રવેશ કરે કરાવે નહીં કે ખેતી કરતા હેલો હરકત અંતરાય કે નુકશાન કરે કરાવે નહીં તેવો દાવાના આખરી નીર્ણય થતા સુધી મનાઈ હુકમ પ્રતિવાદીઓ વીરુદ્ધ ફરમાવવા અરજ કરેલ છે.

(૨) વાદીના દાવાનો સમન્સ તથા નોટીસની બજવણી પ્રતિવાદીઓને થતા આંક-૨૮ થી પ્રતિવાદી તરફે સંયુક્ત દાવા જવાબ રજૂ કરેલ છે. જેમાં મુખ્યત્વે વાદીના દાવાને નકારેલ છે અને બચાવમાં જણાવેલ છે કે, વાદીને દાવો લાવવાનું કારણ ઉત્પન્ન થયેલ નથી. મનાઈ અરજી રદ થવા પાત્ર છે. પ્રતિવાદીએ બચાવમાં જણાવેલ છે કે, પ્રતિવાદીઓ અને વાદીઓ એકજ કુટુંબના સભ્યો છે. વાદીના મૈ.પિતા મનસુખભાઈ દાવાવાળી જમીન પ્રતિવાદીના મૈ. પિતા મનાભાઈ મકવાણાને સને ૧૦૫૦ માં રૂ. ૧૫૦/- માં વેચાણ આપવાનું નક્કી કરેલ હોય પ્રતિવાદીના મૈ.પિતાએ વાદીના મૈ.ઉપિતાને દાવાવાળી જમીનના અવેજ ચૂકવી સને ૧૯૫૦ થી દાવાવાળી મીલકતનો કબજો પ્રતિવાદીના મૈ.પિતા ને સોપેલ. હતો ત્યાર બાદ પ્રતિવાદીના પિતા તથા વાદીના પિતાનું અવશાન થતા દાવાવાળી મીલકત સબંધે તકરાર ઉપસ્થિત થતા સદરહુ દાવાવાળી મીલકતનું ફરી એક વાર વેચાણ કિંમત રૂ.

૧૭,૦૦૦/- સને ૨૦૧૧ માં નક્કી કરવામાં આવેલ અને તે વેચાણ કિંમત તે જ સમયે રોકડેથી ચૂકવી હતી. ત્યાર બાદ પણ વાદી યેનેકેન પ્રકારે દાવાવાળી મીલકત બાબતે વધુ વેચાણ કિંમતની માંગણી કરતા દાવાવાળી મીલકત આખરે કુલ વેચાણ કિંમત રૂ.૧,૨૫,૦૦૦/- સને ૨૦૦૫ માં નક્કી કરવામાં આવેલ. વાદીઓએ પ્રતિવાદીઓની તરફેણમાં પંચ કરાર/ સમાધાન કરાર, બનાખત કરાર તા. ૧૩-૭-૦૫ ના રોજ રૂ.૨૦/- ના સ્ટેમ્પ ઉપર લખી આપેલ. દાવાવાળી મીલકત કુલ વેચાણ કિંમત રૂ.૧,૨૫,૦૦૦/- જણાવવામાં આવેલ અને કુલ અવેજની રકમ પૈકી બાના પેટે રૂ.૩૦૦૦/- રોકડા પ્રતિવાદી ઓએ વાદીઓને ચૂકવેલ હતા. જે અંગેની પાકી પહોચ પણ પ્રતિવાદીઓને લખી આપેલ હતી. ત્યાર બાદ પ્રતિવાદીએ વાદીઓને કુલ વેચાણ કિંમત પૈકી બાકી નીકળતી કિંમત રૂ.૧, ૨૨,૦૦૦/- ટુકડે ટુકડે આજદિન સુધી ચૂકવેલ છે. જેનું લખાણ પ્રતિવાદી પાસે છે. સદરહુ કરારમાં સાક્ષી તરીકે હાલના સરપંચ અને માજી સરપંચ, તથા નાયબ સરપંચની સહી છે. પ્રતિવાદીઓ દાવાવાળી જમીનમાં ખેતી કરતા આવેલ છે અને ઉપજ મેળવતા આવેલ છે તે વાદી જાણે છે. ખરી હકીકતે દાવામાં જણાવેલ તારીખે નહી પરંતુ તા. ૨૪-૬-૧૬ ના રોજ વાદીઓ દાવાવાળી જમીન પ્રતિવાદીઓ પાસેથી પડાવી લેવા દસેક વાગ્યાના સુમારે જમીન ઉપર ઘસી આવી અને ઉગ્ર બોલાચાલી થયેલ જે અંગે પોલીસમાં અરજી પણ થયેલ. દાવાવાળી જમીન પ્રતીબંધીત સતા પ્રકારની હોવાથી પ્રતિવાદીની તરફેણમાં કાયદેસર લખાણ કરતા અગાઉ સરકારશ્રીમાંથી જે પરવાનગી મેળવવી જોઈએ તે તમામ પરવાનગી લાવવાની જવાબદારી વાદીઓની છે. વાદીઓ સદરહુ પરવાનગી લાવવા માંગતા નથી. વેચાણ અવેજ પુરે પુરી રકમનો મેળવેલ હોવા છતા દાવાવાળી જમીન વધી ગયેલા ભાવોના કારણે મોટી રકમ અમો વાદીઓ પાસેથી પડાવવા અગર જમીન પડાવી લેવા

પેરવી કરી રહ્યા છે. દાવાવાળી જમીનનો કબજો પ્રીતવાદીઓ પાસે છે. દાવાવાળી જમીન વાદીના નામથી ચાલતી પ્રતિવાદીઓના કાયદેસરના કબજા ભોગવટામાં છેલ્લા ૫૦ થી ૬૦ વર્ષથી છે. પ્રતિવાદી દાવાવાળી જમીન ખેડતા આવેલ છે તે હકીકત વાદી જાણે છે. વાદીના નામે ચાલતી ખેતીની જમીનનો કાયદેસરનો કબજો ભોગવટો પ્રતિવાદીનો છે. તા. ૧ ૩-૭-૦૫ ના રોજ કરવામાં આવેલ સમાધાન પંચ કરાર મુજબ વાદીઓએ પ્રતિવાદીઓને ફરી એક વખત કબજો સુપરત કરેલ છે. પ્રતિવાદીઓ દાવાવાળી જમીનના વીરુદ્ધ કબજાથી માલીકી હકક મેળવવાથી હકકદાર બનેલ છે. અને તે મુજબ ઠરાવી લેવા માંગણી છે. તે બાબતે પ્રતિવાદીઓએ અલગથી કાઉન્ટર કલેઈમ કરેલ છે.

ત્યાર બાદ આંક-૫ નીચે આ કામના પ્રતિવાદીઓ ધ્વારા દાદ માંગેલ છે કે ,

(૧) દાવાવાળી જમીનમા અમો વાદીઓ ખેતી કરતા આવેલા છે અને અમો વાદીઓને ખેતી કરતા પ્રતિવાદીઓ કે તેમના નોકર ચાકરો એજન્ટો એસાઈનીઓ કુલમુખ્ત્યારો વીગેરે રોકે રાકાવે નહી કે તેમાથી ઉપજ લેતા કે ખેતીના સાધનો લઈ જતા રોકે રોકાવે નહી કે કાયદેસરની કાર્યવાહી કર્યા સીવાય અમો વાદીઓને કબજો લે લેવડાવે નહી તેવો કામ ચલાઉ મનાઈ હુકમ દાવાના આખરી નિકાલ ન આવે ત્યા સુધી પ્રતિવાદીઓ વિરુદ્ધ આપવા હુકમ કરશો.

(૨) સદરહુ દાવાવાળી જમીન આ કામના પ્રતિવાદીઓ અન્ય કોઈ ત્રાહીત ઈસમ કે પેઢીને વેચાણ ગીરો બક્ષીસ કે અન્ય રીતે ટ્રાન્સફર કરે કરાવે નહી કે સદર જમીન ઉપર બોજો ઉત્પન કરે કરાવે નહી તેવો કામચલાઉ મનાઈ હુકમ દાવાનો આખરી નિકાલ ન આવે ત્યા સુધી પ્રતિવાદીઓ વિરુદ્ધ આપવા હુકમ કરશો.

(૩) આ કામે વાદી તર્ફે આંક-૩ થી નીચે મુજબના દસ્તાવેજો રજૂ કરવામાં આવેલ છે.

૧. નિ.૩/૧ થી મોજે ગોરીયાના ખાતા નં.૪૦ ના ૮-અ ના ઉતારાની નકલ.
૨. નિ.૩/૨ થી રે.સ.નં.૫૮/૧ ની ૭×૧૨ ની નકલ.
૩. નિ.૩/૩ થી ફેરફાર નોંધ નં. ૩૯ ની નકલ.
૪. નિ.૩/૪ થી ફેરફાર નોંધ નં. ૧૯૪ ની નકલ.
૫. નિ.૩/૫ થી વાદીના જાતીનો દાખલો.
૬. નિ.૩/૬ થી વાદીના બી.પી.એલ. કાર્ડ

(૪) આ કામે પ્રતિવાદી તરફે નીચે મુજબનું દસ્તાવેજી પુરાવા લીસ્ટ રજુ રાખેલ છે.

- ૧ નિ.૨૭/૧ દાવાવાળી જમીનના ૭/૧૨ ની નકલ
- ૨ નિ.૨૭/૨ દાવાવાળી જમીનના ૮ અ ની નકલ
- ૩ નિ.૨૭/૩ દાવાવાળી જમીનના જમીન મહેસુલની નકલ
- ૪ નિ.૨૭/૪ દાવાવાળી જમીનના પંચકરાર સમાધાન કરારની નકલ
- ૫ નિ.૨૭/૫ દાવાવાળી જમીનના પંચકરારની નકલ
- ૬ નિ.૨૭/૬ વાદીઓએ કરેલ લેખીત ફરીયાદની નકલ
- ૭ નિ.૨૭/૭ વાદીઓએ કરેલ કલેક્ટરશ્રીને ફરીયાદની નકલ
- ૮ નિ.૨૭/૮ વાદીઓના અનુ.જાતીના પ્રમાણપત્ર ની નકલ
- ૯ નિ.૨૭/૯ વાદીઓના મોજે ગામ ગોરીયાના બીપીએલ.કાર્ડ સરનામાની નકલ
- ૧૦ નિ.૨૭/૧૦ પ્રતિવાદીઓના અનુ.જન જાતીના પ્રમાણપત્રની નકલ
- ૧૧ નિ.૨૭/૧૧ પ્રતિવાદીઓના કુણધાનો સરનામુ દર્શાવતો બી.પી.એલ.કાર્ડની

નકલ

૧૨ દાવાવાળી જમીન પ્રતિવાદીઓ ખેડતા હોવાનો તલાટી મંત્રીનો દાખલો.

(૫) વાદી તરફે રજુ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવા લીસ્ટ તથા પ્રતિવાદી તરફે રજુ કરવામાં આવેલ દસ્તાવેજી પુરાવાનો અભ્યાસ કર્યા બાદ અને વાદી તરફે લેખીત દલીલ આંક-૫૮ થી રજુ છે. જે વંચાણે લીધી. પ્રતિવાદીઓ તરફે રજુ રાખેલ ઓર્થોરીટીઓ માન સાથ વંચાણે લીધી.

એ.આઈ.આર. ૧૯૮૪ પંજાબ એન્ડ હરીયાણા પેજ નંબર ૨૬૨ જે માન સાથ વંચાણે લીધી. જે હાથ પરના કેસની હકીકતો સાથે સુસંગત નથી. ત્યારબાદ ૧૯૭૪ કરંટ લો જનરલ પેજ નંબર ૬૩૯ જે માન સાથ વંચાણે લીધું. જે પણ હાથ પર ના કેસની હકીકતો સાથે બંધબેસતું નથી. ત્યારબાદ એ.આઈ.આર. ૧૯૯૬ બોમ્બે ૯૮ જે ડ્યુ પ્રોસેસ ઓફ લો અંગેનું છે. જે હાથ પરના કેસની હકીકતો ને સાથે બંધ બેસતું નથી. ત્યારબાદ જી.એલ.આર. ૨૦૧૨ પેજ નંબર ૨૪૭૭ જે માન સાથ વંચાણે લીધું. જે પણ હાથ પરના કેસની હકીકતો સાથે સુસંગત નથી. ૨૦૦૯ એ.આઈ.આર. સુપ્રીમકોર્ટ પેજ નંબર ૧૦૩ જે માન સાથ વંચાણે લેતા. સદર ઓર્થોરીટીમા પણ જણાવેલ છે કે, એડવર્સ પઝેશન સાબીત કરવા માટે સપષ્ટ અને તમામ જરૂરી હકીકત સાબીત કરવી જોઈએ. સદર કામે પ્રતિવાદી વડીલોપાર્જીત મીલકત અંગે ની તકરાર પણ લીધેલ છે એન એડવર્સ પઝેશનની તકરાર પણ લીધેલ છે. આમ સદર ઓર્થોરીટી પ્રતિવાદીને મદદકર્તા નથી. ત્યારબાદ એ.આઈ.આર. ૧૯૬૪ એસ.સી. ૧૨૫૪ આ અદાલતનું એવું સપષ્ટપણે માનવું છે કે, પ્રતિવાદી વડીલોપાર્જીત મીલકત હોવાનો બચાવ પણ લઈ આવેલ છે અને એડવર્સ પઝેશનની તકરાર પણ લઈ આવેલ છે. જે ના લઈ શકે. જે હાથ પરના કેસમા લીધેલ છે.

આંક-૫ ની અરજીને નીણીત કરવા માટે અત્રેની અદાલત પાસે નીચે મુજબના મુદ્દાઓ ઉપસ્થિત થાય છે.

મુદ્દા નં. ૧ :- શું વાદીનો પ્રાયમાફેસી કેસ છે ?

મુદ્દા નં. ૨ :- શું બેલેન્સ ઓફ કન્વીનીયંશ વાદીની તરફેણમાં છે ?

મુદ્દા નં. ૩ :- શું વાદીને માંગ્યા મુજબનો મનાઈ હુકમ આપવામાં ન આવે તો નાણાંથી ભરપાઈ ન થાય તેવું નુકશાન જાય તેમ છે ?

મુદ્દા નં. ૪ :- શું હુકમ ?

(૬) ઉપરોક્ત મુદ્દાઓના મારા નિર્ણયો નીચે મુજબ છે.

મુદ્દા નં. ૧ :- હકારમા

મુદ્દા નં. ૨ :- હકારમા

મુદ્દા નં. ૩ :- હકારમા

મુદ્દા નં. ૪ :- છેવટના હુકમ મુજબ.

:: કા ર ણો ::

(૭) મુદ્દા નં. ૧ ની ચર્ચા :-

ઉપરોક્ત ત્રણેય મુદ્દાઓ એકબીજા સાથે સંલગ્ન હોય દરેક મુદ્દાઓની અલાયદી ચર્ચા ના કરતા સંયુક્ત ચર્ચા કરવામાં આવેલ છે.

મુદ્દા નંબર ૧ વાદીની મનાઈ હુકમની અરજી નિર્ણીત કરતા સમયે સૌપ્રથમ

પ્રાયમાફેસી કેસ જોવો પડે. આ કામે દાવાવાળી જમીનના માર્ક ૩/૧ થી ગામનમુના

નંબર ૮ અ રજુ છે. જેમા વાદીનું નામ છે. માર્ક ૩/૨ થી ગામનમુના નંબર ૭

અને ૧૨ રજુ છે. જેમા પણ વાદીનું નામ છે. માર્ક ૩/૩ થી દાવાવાળી જમીનનું ગામ

નમુનો નંબર ૬ રજુ છે. જેમા વાદીનું નામ છે. રેવન્યુ રેકર્ડનો ઉતારો માલીકીનો આધાર ન ગણી શકાય. માત્ર કર ઉધરાવવાના આશય થી ધ્યાને લેવામા આવે છે. અમા છતા દાવાવાળી જમીન પર વાદીનો કબ્જો છે. તેવું પ્રાથમીક રેવન્યુ રેકર્ડ ના આધારે કરી શકાય છે. વધુમા દાવાવાળી જમીન વાદીએ માર્ક ૩/૨ થી રજુ રાખેલ ગામનમુના નંબર ૭/ ૧૨ જોતા નવી અને અવીભાજય શરત વાળી જમીન છે. પ્રતિવાદીને તેના કથન પ્રમાણે જો વેચાણ કરેલ હોય તો પણ તે કાયદેસર વેચાણ ગણી શકાય નહી. કારણ કે નવી અને અવીભાજય શરતની ૭૩ એ.એ. વાળી જમીન કલેક્ટરશ્રીની મંજૂરી વિના વેચાણ થઈ શકે નહી. આથી વાદીનો પ્રાયમાફેસી કેસ બને છે. તેમ આ અદાલતનું માનવું છે. આથી મુદદા નંબર ૧ નો જવાબ હું હકારમા આપુ છું.

મુદદા નંબર ૨

બેલેન્સ ઓફ કન્વીનીયન્સ નક્કી કરતી વખતે, વાદીને માગ્યા મુજબની દાદ આપવામાં આવે તો તેનાથી પ્રતિવાદીના હકક ઉપર શુ અરસ પડશે તે જોવાનુ રહેશે અને મનાઈહુકમની અરજીનો નિર્ણીત કરતી વખતે કોર્ટે નક્કી કરવાનુ હોય છે કે માગ્યા મુજબની દાદ ન આપવામાં આવે તો તેની અસર વાદી ઉપર શુ પડે ? સદર કામે વાદીઓએ દાવાવાળી જમીન પર પોતાનો કબ્જો હોવાની હકીકત જણાવેલ છે. જ્યારે પ્રતિવાદીઓએ એડવર્સ પઝેશનથી તેઓ માલીક થયેલા છે. તેવો બચાવ દાવા જવાબ આંક-૨૮ અને આંક-૨૯ ના કાઉન્ટર કલેમમા જણાવેલ છે. પ્રતિવાદીઓએ જ્યારે એડવર્સ પઝેશનથી તેઓ માલીકી હકક મેળવવા હકકદાર બનેલા છે તેવી રજુઆત કરેલ છે ત્યારે સૌ પ્રથમ વાદીની માલીકી

સ્વીકારવી પડે. જે આ કામના પ્રતિવાદીઓ એ આંક-૨૮ અને આંક-૨૯ થી સ્વીકારેલ નથી. એડવર્સ પઝેશનની તકરાર તો જ લઈ શકાય જો વાદગ્રસ્ત મીલકતની માલીકી બીજાની છે તેવું સ્વીકારવામા આવે તેવું આ અદાલતનું માનવું છે. આમ વાદીને માંગ્યા મુજબની દાદ આપવામા આવે તો પ્રતિવાદીના કોઈ કાયદેસરના હકકને નુકશાન થતુ નથી. તેવું આ અદાલતનું માનવું છે. આથી મુદદા નંબર ૨ નો જવાબ હું હકારમા આપુ છું.

મુદદા નંબર ૩

ઈરીપેરેબેલ લોશ નકકી કરતી વખતે અદાલતે વાદી તથા પ્રતિવાદીના કાયદાકીય પાસાઓ જોવાના રહે છે તેવી જ રીતે વાદીએ અદાલતને વ્યવસ્થીત પુરાવો આપવો પડે છે કે તેમના કાયદેસરના હકક હિતને નુકશાન પ્રતિવાદી પહોચાડી રહ્યા છે. પ્રતિવાદીનો બચાવ અને કાઉન્ટર કલેમ આ દાવાના કામે વડીલોપાર્જીત મીલકત અને એડવર્સ પઝેશન બાબતે છે. ઉપરના મુદદામા ચર્ચા થયા પ્રમાણે પ્રતિવાદીએ પ્રથમ વાદીની માલીકી સ્વીકારવી પડે. ત્યારબાદ આગળની કાર્યવાહી થઈ શકે. જે આ કામે પ્રતિવાદીએ સ્વીકારેલ નથી. વધુમા પ્ર તિવાદીઓ દાવો રહ્યો છે કે, વાદીના પિતાએ દાવાવાળી જમીન વેચાણે આપેલ છે. વાદીના પિતાને કીમત પણ ચુકવી આપેલ છે. આ બાબતે પુરાવો લઈ નિર્ણય લઈ શકાય. મનાઈ હુકમની અરજી નિર્ણીત કરતી વખતે સદર હકીકત ધ્યાને લઈ શકાય નહી. ખાસ કરી ને ત્યારે જ્યારે વેચાણ અનરજીસ્ટર અને રોકડે થી થયેલ છે. આમ દાવાવાળી જમીન પર હાલમા વાદીઓના નામ રેવન્યુ રેકર્ડ પર ચાલે છે. ઉપરના મુદદામા ચર્ચા કર્યા મુજબ પ્રાયમાફેસી કેસ વાદીનો બને છે તેમ આ અદાલતનું

માનવું છે. ત્યારે ઈરરીપેરેબલ લોસ વાદીને જાય તેમ છે તેવું આ અદાલતનું માનવું છે. આથી મૃદદા નંબર ૩ નો જવાબ હું હકારમા આપુ છું.

મૃદદા નંબર ૪

ઉપરોક્ત તમામ મૃદદાઓનો અભ્યાસ કર્યા બાદ અને કાયદાકીય જોગવાઈઓનો અભ્યાસ કર્યા બાદ વાદીની દાવા અરજી, પ્રતિવાદીનો દાવા જવાબ કાઉન્ટર કલેમ વાદી તથા પ્રતિવાદી તરફે રજુ થયેલ દસ્તાવેજી પુરાવા લીસ્ટ અને ઓર્થોરીટી માન સાથ વંચાણે લીધા બાદ આ અદાલતનું એવું માનવું છે. વાદીની મનાઈ અરજી અંશતહ મંજૂર થવાને પાત્ર છે. આથી નીચે મુજબ આખરી હુકમ કરવામા આવે છે.

આખરી હુકમ

વાદીની મનાઈ અરજી અંશતહ મંજૂર કરવામા આવે છે.

દાહોદ જીલ્લાના લીમખેડા તાલુકાના ગોરીયાની સીમમમાં આવેલ રે.સર્વે નં. ૫૮/૧ વાળી જમીનમાં આ કામના પ્રતિવાદીઓ જાતે કે તેમના નોકરો, એજન્ટો, માણસો પ્રવેશ કરે કરાવે નહી કે ખેતી કરતા હેલો હરકત અંતરાય કે નુકશાન કરે કરાવે નહી તેવો દાવાના આખરી નીર્ણય થતા સુધી મનાઈ હુકમ પ્રતિવાદીઓ વીરુદ્ધ ફરમાવવા હુકમ કરવામા આવે છે.

પ્રતિવાદીની આંક-૨૯ ની અરજી ના મંજૂર કરવામા આવે છે.

ખર્ચ અંગે કોઈ હુકમ કરવામા આવતો નથી.

લીમખેડા

તા.૧૨/૦૩/૨૦૨૧

(નિરવ એન.રાવલ)

એડી.સીવીલ જજ લીમખેડા

(જી.જે.૦૧૨૫૭)

